

માર્ચ 8, 2018

મ્યુનિસિપલ ઇલેક્શન કન્ટેન્ડર્સ (નગરપાલિકાની ચૂંટણીના પ્રતિયોગીઓ) માટે બ્રામ્પટન માહિતી સત્ર યોજશે

બ્રામ્પટન, ઓન્ટેરિયો – સીટી ઓફ બ્રામ્પટન, વર્ષ 2018 ની નગરપાલિકાની ચૂંટણીમાં સંભવિત ઉમેદવારો અને ત્રાહિત પક્ષ વિજ્ઞાપકો માટે મિનિસ્ટ્રી ઓફ મ્યુનિસિપલ એફર્સ (નગરપાલિકાની બાબતોના મંત્રાલય) સાથેની ભાગીદારીમાં, ગુરુવાર, એપ્રિલ 3, 2018 નાં રોજ એક માહિતી સત્રનું આયોજન કરશે.

આ માહિતી સત્ર નીચેના સરનામે સાંજે 6:30 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા વચ્ચેના સમયમાં યોજાશે.

Council Chambers, City Hall, 2 Wellington Street West, Brampton (કાઉન્સિલ ચેમ્બર્સ, સીટી હોલ, 2 વેલિંગ્ટન સ્ટ્રીટ વેસ્ટ, બ્રામ્પટન)

આ સત્ર ઉમેદવાર અને ત્રાહિત પક્ષ વિજ્ઞાપકની પાત્રતા અને જવાબદારીઓ, નામાંકન અને નોંધણી પ્રક્રિયા, કેમ્પેઇન ફાઇનાન્સીસ (ઝુંબેશને લગતી નાણાકીય બાબતો), તેમજ મુખ્ય તારીખો અને સંસાધનોને લગતી માહિતી સહિત, મુખ્ય જરૂરિયાતોનો સારાંશ પૂરો પાડશે.

ઝાંખીઓ

- આ સત્રમાં 2018 ની નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે દોડમાં હોવાનું વિચારનાર, અથવા ત્રાહિત પક્ષ વિજ્ઞાપક તરીકે નોંધણી કરાવનાર કોઈપણ વ્યક્તિ હાજર રહી શકે છે
- નોંધણી ફરજિયાત છે કારણ કે તેમાં સીમિત બેઠકો છે – નોંધણી કરાવવા કૃપા કરી bramptonvotes@brampton.ca ને ઇમેલ મોકલો અને જણાવો જો તમે એક સંભવિત ઉમેદવાર કે ત્રાહિત પક્ષ વિજ્ઞાપક હો
- એક ઉમેદવાર કે ત્રાહિત પક્ષ વિજ્ઞાપક બનવાને લગતી માહિતી [અહીં જોઈ શકાય છે](#)
- ઉમેદવાર નામાંકન સમયગાળો મે 1 નાં રોજ ખુલે છે અને જુલાઈ 27 નાં રોજ બંધ થાય છે
- ત્રાહિત પક્ષ વિજ્ઞાપક નોંધણી મે 1 નાં રોજ ખુલે છે અને ઓક્ટોબર 19 નાં રોજ બંધ થાય છે
- મતદાનની તારીખ ઓક્ટોબર 22 છે
- નામાંકિત ઉમેદવારો અને નોંધાયેલા ત્રાહિત પક્ષો માટે આગામી માહિતી સત્ર સપ્ટેમ્બર 2018 માં યોજાશે
- વધુ માહિતી માટે, ચૂંટણી સંયોજક (ઇલેક્શન્સ કોર્ડિનેટર), Shauna Danton (શોના ડોન્ટન) નો સંપર્ક 905.874.3952 નંબર પર કરો.

અવતરણ (ક્વોટ):

“મ્યુનિસિપલ ઇલેક્શન્સ એક્ટમાં તાજેતરમાં થયેલા ફેરફારોમાં ત્રાહિત પક્ષ વિજ્ઞાપન નિયમો અને કાઉન્સિલ માટે ઉમેદવારની જરૂરી મતદાર સમર્થન) જેવી નવી જોગવાઈના ઉમેરોનો સમાવેશ થાય છે. આનું પહેલી વાર અમલીકરણ 2018 માં થવાનું હોવાથી, માહિતી સત્ર સંભવિત ઉમેદવારો પાસેથી શું જરૂરી બને છે, તેઓને તેની વધારે સારી સમજ મેળવવામાં મદદરૂપ થશે, અને આ સત્ર ત્રાહિત પક્ષ વિજ્ઞાપકોને નોંધણી જરૂરિયાતો વિશે વધુ જાણવામાં પણ મદદરૂપ થશે.”

- પીટર ફે (Peter Fay), સીટી ક્લાર્ક, અને 2018 નાં બ્રામ્પટન મ્યુનિસિપલ ઇલેક્શન માટે ચૂંટણી અધિકારી (રિટર્નિંગ ઓફિસર)

-30-

બ્રામ્પટનમાં મોટા પાયે ફેરફારો થઈ રહ્યાં છે. આપણે વેધક ધ્યાન કેન્દ્રિત કરતા ભવિષ્ય માટે તૈયાર સંસ્થા છીએ. આપણે આપણાં સમુદાયની વૃદ્ધિ જાણીએ છીએ, જુવાની અને વિવિધતા આપણને અલગ અલગ કરે છે. આપણે કેનેડાના નવીન શોધ કરતા સુપર કોરિડોરના કેન્દ્રમાં સ્થિત, રોકાણ પ્રોત્સાહક અને આપણી વૈશ્વિક સફળતા વિકસાવનાર છીએ. આપણે કંપાયમાન શહેરી કેન્દ્રો વિકસાવીએ છીએ જે તક પ્રજ્વલિત કરે છે અને અહીં રહેતા અને કાર્યરત લોકોમાં ગૌરવ રેડીએ છીએ. આપણે બ્રામ્પટનને આગળ વધારી રહ્યાં છીએ જે તેને નવીનતમ, સર્વગ્રાહી અને જુરસામય શહેર બનાવે. અમને [Twitter](#) અને [Facebook](#) પર અનુસરો. www.brampton.ca પર વધુ માહિતી જાણો.

મીડિયા સંપર્ક (MEDIA CONTACT)

નાટાલી સ્ટોગડિલ (Natalie Stogdill)

મીડિયા કોર્ડિનેટર (Media Coordinator)

સીટી ઓફ બ્રામ્પટન (City of Brampton)

905.874.3654 | natalie.stogdill@brampton.ca